



બોટીંગ કરતી વખતે-

છલતી (સ્પીલવે) તેમજ પાણી લેવાના બારાથી દૂર રહેશો કેમ કે ત્યાં તીવ્ર પ્રવાહ વહેતો હોય છે.

કાચી નહેરની સપાટી ઉપર પથ્થરના ટુકડાઓથી સાચવશો.

છુદ્ધ પથ્થર, જળાશયમાં પાણીમાંથી બહાર નીકળતા દેખાતા ખડક, ટાપુઓ અને તરતા લાકડાં જોતાં રહેશો.

પાણીનો પ્રવાહ બદલાતાં ગતિ તેમજ પાણીની ઉંડાઈમાં ઘણો જ ફરક પડી શકે છે તે ધ્યાનમાં લેશો.

જળાશય આગળ અથવા વહેતી નહેરમાં
આપની સુરક્ષા માટે આટલું કરશો

માછીમારી કરતી વખતે-

એકલા ક્યારેય માછીમારી કરશો નહિ.
કોઈકને સાથે રાખશો જે તમને મુશ્કેલીમાં મદદ કરી શકે.

પાણીમાં પડી ગયેલ વસ્તુ પાછી લેવાની કોશિશ કરશો નહિ. આપની વસ્તુ ચોકકસ જશે પણ જીંદગી બચી જશે.

સુરક્ષા જેકેટ અને રીંગ તથા બચાવ માટેના સાધનો સાથે રાખશો.

ઝેરી સાપનું ધ્યાન રાખશો.

પાણીમાં જતાં રેમ્પ કેટલે સુધી
લંબાય છે તેની ચકાસણી કરશો.

સુરક્ષા જેકેટ પહેરશો.



જળાશય અથવા વહેતી નહેરમાં આપની સુરક્ષા માટે આટલું કરશો

નહેરને ઓળંગતા પુલોથી દૂર રહેશો

નહેરની કોન્ક્રીટની સપાટીથી સાચવશો કેમ કે તે લપસી જવાય તેવી હોય છે અને ચઢીને બહાર નીકળી શક્ય તેવું હોતું નથી

રબરના તળીયાવાળા બૂટ પહેરશો જેથી નહેરમાં લપસી ન જવાય

આ જગ્યાએ તીવ્ર પ્રવાહ ઉપર નજર રાખશો-

નહેરમાં વહેતા પાણીની સપાટી હંમેશા છેતરામણી હોય છે.

નહેરમાંનું શાંત પાણી એકાએક વહેવાનું શરૂ કરી દે છે જેથી પણ તીવ્ર પ્રવાહ અને વમળો ઉત્પન્ન થાય છે.

સાચફન, પાઇપલાઇન વગેરેમાં ખેંચાઇ જવાની શક્યતાઓ વધારે હોય છે એટલે તેનાથી દૂર રહેવું જોઇએ